

લોકભારતી, સણોસરા

સાયં પ્રાર્થના

(1)

ઇશાવાસ્યં ઇદં સર્વ યત્કિંચ જગત્યાં જગત् ।  
તેન ત્યક્તેન ભુંજીથા: મા ગૃધ: કસ્યસ્વિદ્ ધનમ् ॥

હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ् ।  
તત્ ત્વં પૂષન્ અપાવૃણ સત્ય ધર્માય દૃષ્ટયે ॥

અગિનર્યથૈકો ભુવનં પ્રવિષ્ટો રૂપં રૂપં પ્રતિરૂપો બભૂવ ।  
એકસ્તથા સર્વભૂતાન્તરાત્મા રૂપં રૂપં પ્રતિરૂપો બહિશ્ચ ॥

નથી મને કામના રાજ્યની વા, ના સ્વર્ગની, ના ભવ છૂટવાની;  
છે કામના એ બસ હું ખપું સૌ, પીડાર્ત કેરાં દુઃખ ટાળવામાં.

દુવારકે વસનાર ઓ! ગોધનપાલક કા'ન! કૌરવ લૂંટે લાજ, હાં! ધા મારી ધર કાન!  
કરેલાં કર્મને લેખે જ્યાં જ્યાં જન્મ મળે મને, ભક્તિ મારી સદા નાથ! તારામાં દદ ત્યાં હજો!

જેના રદ્દિયામાં વસ્યા, રાધાવર ધનશ્યામ; એનો જ્ય છે સર્વદા, એને લાભ તમામ.  
રોટીને વસ્ત્રની ચિંતા, ઠાલી ભક્તજનો કરે; વિશ્વને પોષનારો શું ભૂખ્યાં રાખે સ્વભક્તને?

મેઘોથી પડતું પાણી, જેમ સાગરમાં વહે;  
પ્રણામો સર્વ દેવોને, પહોંચે જે વિશ્વનાથને.

દ્યાવાનને કરું પ્રણામ, ફૂપાવાનને કરું પ્રણામ.  
વિશ્વ સકલનો માલિક તું, અંતિમ દિનનો ચાલક તું.  
તારી ભક્તિ કરું સદા, તવ અવલંબન રહો સદા.

આ છે છેલ્લી યાચના આપ પાસે,  
મારા ઊંડા છેક અંતઃસ્તલેથી; છેદી નાંખો કીણતા સર્વ મારી,  
પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી!

કંગાલોને માનહીણા કરું ના,  
જાલિમોને પાય ઝૂકી પડું ના,  
ઉંચે માથે ક્ષુદ્રતાની વચ્ચાળે,  
ચાલું એવી શક્તિ આપો પ્રભુજી!

(2)

હર શુક્રવાર કો ધૂન કે બદલે

સર્વધર્મ પ્રાર્થના

ॐ તત્ત્વસત् શ્રી નારાયણ તરૂ પુરુષોત્તમ ગુરુ તરૂ;  
સિદ્ધ-બુદ્ધ તરૂ સ્કંદ વિનાયક, સવિતા પાવક તરૂ.  
ब्रह्म मज्द तरू यहव शक्ति तरू ईशु पिता, प्रभु तरू;  
रुद्र-विष्णु तરू रामकृष्ण तરू रहीम ताओ तरू.  
વાસુદેવ ગો-વિશ્વરૂપ તરू ચિદાનંદ હરિ તરू  
અદ્વિતીય તરૂ અકાલ નિર્ભય, આત્મલિંગ શિવ તરૂ.  
ॐ તત્ત્વસત् શ્રી નારાયણ તરૂ પુરુષોત્તમ ગુરુ તરૂ.

જેને દિવ્ય સત્ત્વો વડે સત્ત્વી રહ્યાં, સૂર્યાંજિ વા વાદળાં;  
 જેનો મંત્ર પુરાણ, શાસ્ત્ર, વચનો ગાયે ઋષિ વ્યાકુળા,  
 યોગી ધ્યાન ધરી જ સંયમ કરી, જેની કરે ઝંખના,  
 જેનો પાર ન કોઈએ લઈ શક્યાં, તે દેવને વંદના.

-: સ્થિતપ્રશ્ન દર્શન :-

(શ્રીમદ્ભગવન્તીતા અધ્યાય બીજો, શ્લોક 54થી 72)

શ્રી અર્જુન બોલ્યા :

સમાધિમાં સ્થિતપ્રશ્ન, જાણવો કેમ કેશવ? બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિર બુદ્ધિનો  
 શ્રી ભગવાન બોલ્યા :

મનની કામના સર્વે છોડીને આત્મમાં જ જે, રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રશ્ન જાણવો.  
 હુઃખે ઉદ્દેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ, ગયા રાગ-ભય-કોષ, મુનિ તે સ્થિર બુદ્ધિનો.  
 આસક્ત નહીં જે ક્યાંય, મય્યે કાંઈ શુભાશુભ, ન કરે હર્ષ કે દ્રેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.  
 કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી, સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.  
 નિરાહારી શરીરીના, ટણે છે વિષયો છતાં, રસ રહી જતો તેમાં, તે ટણે પેખતાં પરં.  
 પ્રયત્નમાં રહે તોયે શાણાયે નર ના હરે, મન ને ઈન્દ્રિયો મસ્ત, વેગથી વિષયો ભણી.  
 ધોગથી તે વશે રાખી, રહેવું મત્પરાયણ, ઈન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.  
 વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે, જન્મે આસક્તિથી કામ, કામથી કોષ નીપજે.  
 કોષથી મૂઢતા આવે, મૂઢતા સમૃતિને હરે, સમૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશો વિનાશ છે.  
 રાગ ને દ્રેષ છૂટેલી ઈન્દ્રિયે વિષયો ગ્રહે, વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસત્તા.  
 પાખ્યે પ્રસત્તા તેનાં હુઃખો સહુ નાશ પામતાં, પાખ્યો પ્રસત્તા તેની બુદ્ધિ શીધ બને સ્થિર.  
 અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના, ન ભાવહીનને શાંતિ સુખ ક્યાંથી અશાંતને?  
 ઈન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠ જે વહે મન, દેહિની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે.  
 તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયો થકી, ઈન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.  
 નિશા જે સર્વ ભૂતોની, તેમાં જગત સંયમી, જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા.  
 સદા ભરાતાં અચલ પ્રતિષ્ઠ, સમુદ્રમાં નીર બધાં પ્રવેશો,  
 જેમાં પ્રવેશો સહુ કામ તેમ, તે શાંતિ પામે નહીં કામકામી.

છોડીને કામના સર્વે, ફરે જે નર નિઃસ્પૃહ, અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત.  
 આ છે બ્રહ્મદશા એને પાખ્યે ના મોહમાં પડે, અંતકાળેય તે રાખી બ્રહ્મ નિર્વાણ મેળવે.